

Ref: OFL/BSE/2025 Date: 15th February 2025

To,

BSE Limited

Corporate Relations Department Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400001.

Re: Optimus Finance Limited

Scrip Code: 531254

Subject: Newspaper Publication - Unaudited Financial Results for the Third Quarter/

Nine months ended 31st December 2024.

Ref: Intimation under Regulation 30 & 47 and all other applicable regulations, if

any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015, as amended from time to time.

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, we hereby enclose newspaper clippings of the Unaudited Financial Results of the Company for the Third Quarter/Nine months ended on 31st December 2024, published on **Saturday, 15th February 2025** in the below-mentioned Newspapers:

- i. Financial Express English language newspaper &
- ii. Financial Express Vernacular language newspaper.

The advertisement also includes a Quick Response code and the weblink to access complete financial results for the said period.

Further, the Company has also disseminated the above published information on the Company's website at www.optimusfinance.in.

Kindly take the same on your records.

Thanking you, Yours faithfully,

FOR: OPTIMUS FINANCE LIMITED

Krati Gupta

Company Secretary & Compliance Officer

Enclosures: As above

SATURDAY, FEBRUARY 15, 2025

OSBI STATE BANK OF INDIA

Bavia (01317)

POSSESSION NOTICE [RULE - 8 (1)] (For ____ovable property)

Whereas, The Authorized Officer of the State Bank of India, under the Securityation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the power conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 03-12-2024 under Section 13(2) of the said Act, calling upon the borrower. JANAKBEN JASHUBHAI ALGOTAR (borrower) wid/ of JASHUBHAI ALGOTAR to repay the amount mentioned in the afgrementioned notice being Rs. 1212458.18 (Twelve lacs Twelve thousand Four hundred fifty Eight and eighteen palse only) as on 92-12-2024 together with further contractual interest thereon till the date of payment and incidental expenses, costs and charges incurred/ to be incurred, until the date of payment within 60 (Sixty) days from the date of said notice.

The borrower / guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower / guarantors and the public in general that the undersigned has taken SYMBOLIC POSSESSION of the property described hereinbelow in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the 12TH Day of Feb 2025.

The borrower / guaranter in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the State Bank of India for an amount of Rs.1212458.18 (Twelve lacs Twelve thousand Four hundred fifty Eight and eighteen palse only) as on 02-12-2024 together with further contractual interest thereon from 27-07-2024 till the date of payment and incidental expenses, costs and charges incurred/to be incurred until the date of payment.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All Piece and parcel of Property at V.P. No 95-96-97 of Mouje Shiyal, Tal-Bayla Dist Ahmedabad 1.Boundaries of Property V.P No-95 East- Open plot, West- Road, North-House of Janakben Jashubhai, South- Road 2. Boundaries of Property V.P No-96 East-Open plot, West- Road, North- House of Janakben Jashubhai, South- House of Janakben Jashubhai 3. Boundaries of Property V.P No-97 East- Open plot, West-Road North-Ishabhai Bhurabhai, South-House of Janakben Jashubhai

Date: 12.02.2025 Place: Ahmedahad

Authorized Officer STATE BANK OF INDIA

60 IDBI BANK

Retail Recovery, Rajkot

APPENDIX IV (RULE 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas The undersigned being the Authorised officer of IDBI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 31/12/2023 calling upon the borrower (1) Mr. PARAS NANDA (Borrower) and (2) Mrs. MINABEN NANDA (Co-Borrower), to repay the amount mentioned in the notice being Rs 24,83,607/- (Rupees Twenty Four Lakh Eighty Three Thousand Six Hundred Seven Only) together with further interest thereon with effect from 10/10/2023 to IDBI Bank withen 60 days from the date of the receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property described herein helpw, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 6th day of February of the year 2025.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDBI Bank Limited for an amount of Rs 24,83,507/- (Rupees Tweety Four Lakh Eighty Three Thousand Six Hundred Seven Only) and interest thereon.

The borrower's ettention is invited to provisions of sub section (B) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE PROPERTY

The Mortgaged Assets All that piece and parcel of immovable property which is Residential property situated at "Flat No 404, 4th Floor, admeasuring 95.34 sq.mt (super built up area), Tower C, Riddhi Siddhi Residency, constructed on amalgamated Plot no 192 to 195, Survey No 1247 paiki, 1248 paiki and 1249 paiki, Vasant Vatika Society, Nr. Central Bank, Nr. Leuva Patel Samaj, Ranjitsagar Road, Jamnagar, (Gujarat) 361005," in the state of Gujarat and Bounded as under : On the East by: OTS and Flat No. A/403, On I the West by: Platino, C/403, On the South by: Lift, Flatilio 401, On the North by: OTS Together with all and stagular the structures and erections thereon, both present and

Date: 08.02.2925	Authorized Officer
Place: Rajkot	IDBI Bank Limited (IDBI)

Home Finance

- 393001, on 19-01-2022.

Motilal Oswal Home Finance Limited

CIN Number :- U65923MH2013PLC248741 Corporate Office: Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opposite ST Depot, Prabhadevi, Mumbai-400025. Email: hfquery@motilaloaswal.com.

PRIVATE TREATY

Date: 15-02-2025 **VIRENDRA KUMAR PEMARAM PRAJAPAT** P NO. - 224, DRUPARK SOCIETY, GODADRA NAHER ROAD, NEAR GYAN JYOT

SCHOOL, GODADARA, SURAT, GUJARAT - 395010 SHOP NO - 138, UMIYA NAGAR SOCIETY, NEAR MAHARANA PRATAP CHOWK, GODADARA, SURAT, GUJARAT - 395010 MANJUDEVI VIRENDRAKUMAR PRAJAPAT

P NO. - 224, DRUPARK SOCIETY, GODADRA NAHER ROAD, NEAR GYAN JYOT SCHOOL, GODADARA, SURAT, GUJARAT - 395010 (Hereinafter collectively referred to as the "Borrowers")

SUBJECT: LOAN A/C NO. LXKAD00416-170048190 PRE-SALE NOTICE UNDER RULE 8 (6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 OF 15 DAYS FOR SALE OF SECURED ASSET PROPERTY MORTGAGED WITH Motilal Oswal Home Finance Limited (Earlier known as Aspire Home Finance Corporation Limited hereinafter referred as MOHFL) ("Secured Creditor").

Dear Sir/Madam, That despite service of demand notice dated 19-12-2020 U/s 13(2) of the Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act"), you, the above named Borrowers and Guarantors failed to make the payment of demanded amount of Rs.1113882/- (Rupees Rupees Eleven Lac Thirteen Thousand Eight Hundred Eighty Two Only) within 60 days of the said and as such the authorized officer of the Secured Creditor took the possession of Secured Asset property PLOT NO - 135, R.S NO - 250-B, GREEN AVENUE, UTIYADARA ROAD, GOKULDHAM RESIDERCY, MOUJE - UTIYADARA, KOSAMBA, BHARUCH, GUJARAT

We had conducted public e-auctions to sell secured asset but all the auctions got failed as we did not receive any bid. Therefore we are intending to sell the secured asset by way

In consultation with the Secured Creditor the reserve price for the sale of above mentioned secured asset property, is fixed at Reserve Price Rs.300000/- (Rupees Three Lakh Only). The Property is having no encumbrances as per knowledge of the Secure Creditor. The Borrowers' and Guarantors' attention is invited to provisions of sub-section (8) of Section 13 of SARFAESI Act, 2002 in respect of time available, to redeem the secured

This Notice is being given to you the addresses in compliance of Rule 8 (6) of Security Interest (Enforcement) Rules, 2002 and you are hereby informed and notified that the aforesaid secured asset shall be sold after 15 clear days from this notice by way of Private Treaty on 10-03-2025 at Office No. 214, 3rd Floor, Shyam Arcade, Block no. 66, Plot No. 1 to 6 A,B,C, Nr. Modi hospital, Bardoli Road, Maninagar, Kadodara, Surat, Gujarat - 394327 or thereafter on some other day through Private Treaty

Yours truly,

(Authorized Officer) **Motilal Oswal Home Finance Limited**

IDBI BANK

the 8th day of February of the year 2025.

Retail Recovery, Rajkot

APPENDIX IV (AULE 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas The undersigned being the authorized officer of IDBI Bank Limited under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 31/12/2023 along with corrigendum dated 25/84/2024 calling upon the borrower (1) Mr. DIVYARAJSINH JADEJA (Borrower) and (2) Mrs. ASHVINABA JADEJA (Co-Borrower), to repay the amount mentioned in the notice being Rs. 19,77,848.31/- (Rupees Mineteen Lakhs Seventy Seven Thousand Eight Hundred Forty Eight and thirty one paisa Only)

days from the date of the receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property. described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this

together with further interest thereon with effect from 10.10.2023 to IOBI Bank within 60

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDBI Bank Elmited for an amount of Rs. 19.77,848.31/- (Rupees Miceteen Lakhs Seventy Seven Thousand Eight Hundred and Forty Eight and thirty one palsa Only) together with further interest thereon with effect from 10.10.2023.

The borrower's attention is invited to provisions of sub section (B) of section 13 of the

Act, in respect of time available, to redeem the secured assets. DESCRIPTION OF THE PROPERTY

 All That piece and parcel of immovable property situated at "TEI Room (office) No 108, 1st Floor, Halar House", Behind Nagnath Gate Police Chowki, admeasuring super built up area 20-23 sq. mt., on first floor of building known as HALAR HOUSE, which is constructed on R.S. No. 274/3, Sub Piot No. A/1, New City Survey No. 585/B/5, Sheet no. 241, Hak Choksi Ward No. 11, B/h Star Complex, Nr Nagnath Gate, Off. Indira Gandhi Road, Jamnagar, Tal & Dist, Jamnagar – 361006 in the state of Gujarat.

Together with all and singular the structures and erections thereon, both present and future which is bounded as under On the East by: 1-80 Mt. wide entrance balcony, On the West by : Room No. 110 property, On the North by: 1-80 Mt, wide entrance balcony/Passage, On the South by: Room No. 128 property

All That piece and parcel of immovable property situated at "TEI Room (office) No 110, 1st Floor, Halar House", Behind Nagnath Gate Police Chowki, admeasuring super built up area 20-23 sq. mt., on first floor of building known as HALAR HOUSE, which is constructed on R.S. No. 274/3, Sub Piot No. A/1, New City Survey No. 585/B/5, Sheet no. 241, Hak Choksi Ward No. 11, B/h Star Complex; Nr Nagnath Gate, Off, Indira Gandhi Road, Jamnagar, Tai & Dist. Jamnagar – 361096 in the state of Gujarat.

Together with all and singular the structures and erections thereon, both present and future which is bounded as under On the East by: Room No 108 property, On the West by: Room No 112 property, On the North by: Room No 109 property, On the South by: 1 20 Mt. wide entrance balcony,

Date: 08.02.2025 Place: Rajkot

Authorized Officer 1081 Bank Limited (IDBI)

NIWAS HOUSING FINANCE PRIVATE LIMITED

(Formerly known as Indostar Home Finance Private Limited, hereinafter referred as NHFPL) Regd. Office: - Unit No. 305, 3rd Floor, Wing 2/E, Corporate Avenue, Andheri- Ghatkopar Link Road, Chakala, Andheri (East), Mumbai – 400093

NIWAS HOUSING FINANCE

POSSESSION NOTICE [Rule 8 (1) and (2)]

Whereas, The Authorized Officer of the Secured Creditor mentioned herein, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act), 2002 and in exercise of powers conferred under Section 13(2) read with (Rule 3) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the borrower(s) to repay the amount mentioned in the notice within 60 days from-the date of receipt of the said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the borrower(s) and the public in general that

the undersigned being the Authorized Officer of NHFPL has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on the date mentioned against each property. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to

redeem the secured assets. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the NHFPL for the amount mentioned below and interest and other

charges thereon Loan Account Borrower(s) & Amount & Date of Possession Date of Number **Property Details Demand Notice** Possession Status LNSUR0HL- 1.SURAJKUMAR SINGH 12-Feb-2025 SYMBOLIC Rs. 10,59,412/- (Rupees Ten 03220022902 (BORROWER) Lakh Fifty Nine Thousand **POSSESSION** 2.RIBHA SURAJBHAI SINGH Four Hundred Twelve Only) CO-BORROWER) DATE: 14-Jun-2024

PROPERTY BEARING: :- All That Piece And Parcel Of The Property Bearing Plot No. - 279, Admeasuring 80.22 Sq. Yards I.E. 67.07 Sq. Mts. (As Per Approved Plan Admeasuring 62.81 Sq. Mts.), Together With Undivided Proportionate Share Admeasuring 45.92 Sq. Mts. In Road & Cop, Total Admeasuring 112.99 Sq. Mts. In "Shrungal Homes", Situated On The Land Bearing Revenue Survey No.76/Paiki, 96/ 1 Paiki, 75/Paiki, Block No.343/ A Admeasuring 21853 Sq. Mts. & Block No.343/B Admeasuring 24989 Sq. Mts., Total Admeasuring 46842 Sq. Mts. Of Village: Bharundi, Sub - District: Olpad, District: Surat.

Place: GUJARAT Date: 15.02.2025

Authorized Officer NIWAS HOUSING FINANCE PRIVATE LIMITED

Authorised Officer

* MANAPPURAM

MANAPPURAM HOME FINANCE LIMITED FORMERLY MANAPPURAM HOME FINANCE PVT LTD

CIN: U65923K12010PIC039179 Regd Office: IV/470A (DLD) W/638A (NEW) Manappuram House Valapad Thrissur, Kerala 680567

Corp Office: Manappuram Home Finance Limited, Third Floor, Unit No. 301 to 315, A Wing, 'Kanaka Wall Street', Andheri-Kurla Road, Andheri East, Mumbai-400093, Maharashtra, Phone No.: 022-66211000, Website: www.manappuramhomefin.com

DEMAND NOTICE

Whereas the Authorized Officer of Manappuram Home Finance Ltd., having our registered office at IV/470A (old) w/638A (new) Manappuram House, Valapad, Thrissur, Kerala-680567 and branches at various places in India (hereinafter referred to as "MAHOFIN") is a Company registered under the Companies Act, 1956 and a Financial Institution within the meaning of sub-clause (by) of clause (m) of sub-section (1) of Section 2 of the Securitization and Reconstruction of financial Assets and Enforcement of Security Interest Act. 2002 (hereinafter referred so as the Act) read with Notification No. S.O. 3466 (E) dated 18th December, 2015 issued by the Govt, of India, Department of Financial Services, Ministry of Finance, New Delhi, Inter alia carrying on business of advancing loans for construction and / or purchase of dwelling units and whereas the Borrower / Co-Borrowers as mentioned in Column No. 2 of the below mentioned chart obtained loan from MAHOFIN and whereas MAHOFN being the secured creditor unde the SARFAESI Act, and in exercise of powers conferred under section 13(2) of the said Act read with Rule 2 of the security interes Enforcement) Rules 2002, issued demand notice calling upon the Borrowers / Co-Borrowers as mentioned herein below, to repay the amount mentioned in the notices with further interest thereon within 60 days from the date of notice, but the notices could not be served upon some of them for various reasons. That in addition thereto for the purposes of information of the said borrowers

Sr. Hol	Name Of The Berrower/ Co-Berrower/Lan/Branch	Description Of Secured Asset In Respect Of Which Interest Has Seen Created	Npo Date	Date Of Motice Sevi & Outstanding Amount
1	Sakarben Rammikibhai Kuwarkya Rammikibhai Girdharbhai Kunvaria Sanjaybhai Rammikibhai Kunvariya /46/100236604222/ Ahmedabad	House over land measured 200-00 sq. yards, of Situated at atkot gram Tal Property No. 639, Aren Atkot, Sub Dis:-Jasdan Dist-Rajkot, PO. Atkot, Rajkot, Gujarat, Ph.: 360040. East-Others property, West-Others property, South-Road, North-Others property	16-01-2025	22-01-2025 & Rs. 317712/-

Notice, is therefore given to the Sorrowers / Co-Borrowers, as mentioned herein above, calling upon them to make payment of the total outstanding amount as shown harein above, against the respective Borrower / Co-Borrower, within 60 days of publication of this notice, Failure to make payment of the total outstanding amount together with further interest by the respective Borrower/ Co-Borrower, MAHOFIN shall be constrained to take u/s 13(4) for enforcement of security interest upon properties as described above. steps are also being taken for service of notice in other manners as prescribed under the Act and the rules made hereunder. You are put to notice that the said mortgage can be redeemed upon payment of the entire amount due together with costs, charges and expenses incurred by MAHOFIN at any time before the date of publication of notice for public auction or private treaty for interster by way of sale, as detailed in Section 13(8) of the SARFAESI Act.

Take note that in terms of 5-13 (13) of the SARFAESI Act, you are hereby restrained from transferring and/or dealing with the Secured Properties in any manner by way of sale, lease or in any other manner.

Dain: 15" February 2025 Place: GUJARAT Manappuram Home Finance Ltd

enumerated below, the said borrowers are being informed by way of this public notice.

Shri Jagdamba Polymers Limited CIN: L17239GJ1985PLC007829

Registered Office: HARMONY, 4th Floor, 15/A, Shree Vidhyanagar Co.op. Hsg. Soc. Ltd., Opp. Nabard, Nr. Usmanpura Garden, Ahmedabad – 380014 • Tel.: 079-26565792, E-mail Id: admin@jagdambapolymers.com • Website: www.shrijagdamba.com

Ext	Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Month ended 31/12/2024												
					(Rs. In Lakhs	except EPS)						
Sr.		(Quarter ende	d	Nine mor	Year ended							
No.	Particulars Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024						
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited						
1	Total income from operations (net)	11579.32	12789.40	7183.42	36701.63	25543.91	36700.75						
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1628.73	1335.23	1160.30	4197.73	3532.15	4433.52						
3	Net Profit for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	1628.73	1335.23	1160.30	4197.73	3532.15	4433.52						
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1366.52	881.54	833.85	3201.23	2443.79	3227.34						
5	Total Comprehensive income for the period (Comprising Profit for the period (after Tax) and other Comprehensive income (after Tax)	1366.52	881.54	833.85	3201.23	2443.79	3227.34						
6	Equity Share Capital	87.58	87.58	87.58	87.58	87.58	87.58						
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year)		-			_	24417.53						
8	Face Value Of Equity Share Capital	1/-	1/-	1/-	1/-	1/-	1/-						
9	Earnings Per Share (before and after extraordinary items) Basic / Diluted:	15.60	10.07	9.52	36.55	27.90	36.85						
Not	ec.												

(i) The aforesaid financial results were placed before and reviewed by the Audit Committee at its meeting held on 14/02/2025 and approved by the Board of Directors at its meeting held on the same date. (ii) Information on Standalone Financial Results are as follows:

Sr.		(Quarter ende	d	Nine mor	Year ended	
No.	Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)	11579.32	12789.40	7183.42	36701.63	25543.91	36700.75
2	Profit/ (Loss) before Tax	1628.73	1335.23	1160.30	4197.73	3532.15	4433.52
3	Profit/ (Loss) after Tax	1366.52	881.54	833.85	3201.23	2443.79	3227.34

(iii) The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and nine months ended on December 31, 2024, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Unaudited Financial Results is available on the Stock Exchange website i.e. www.bseindia.com end company website www.shrijagdamba.com.

Date: 14.02.2025 Place: Ahmedabad



For, Shri Jagdamba Polymers Ltd. Ramakant Bhojnagarwala Managing Director (DIN: 00012733)

[All amounts are in lakhs, unless otherwise stated.]

Date: 14.02.2025

Place: Ahmedabad

Date: 30.01.2025

Place: Ahmedabad

OPTIMUS FINANCE LIMITED OPTIMUS CIN: L65910GJ1991PLC015044

Regd. Office: 504A "OZONE", Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi, Vadodara - 390003. Ph: 0265 - 2325321 | Website: www.optimushnance in | Email: info@optimushnance in

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER & NINE MONTHS ENDED 31ST DECEMBER 2024.


		Consolidated									
			Quarter End	ed	Nine Mon	Year Ended					
200	Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024				
		(Un-audited)	(Un-sudited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)				
	Total Income from operations (Net) Net Profit / (Loss) for the period (before	3801.21	3858.78	2635.78	11450.89	7314.33	11418.08				
1	Tax, Exceptional and/or Extraordinary flame) Net Profit / (Loss) for the period before tax	343.58	278.54	310,14	886.72	601.29	918.05				
	(after Exceptional Wor Extraordinary Name)	343.58	278.54	310.14	886.72	801.29	918.05				
	Net Profit / (Loss) for the period after tax (after Exceptional &/or Extraordinary items)	295.91	229.43	268.38	753.67	540.03	822.33				
-	Total Comprehensive Income for the period Equity Share Capital	393.78	247.71	228.10	889.84	455.09	887.94				
	(Face Value Rs. 10/- per share)	747.23	747.23	747.23	747.23	747.23	747.23				
1	Reserves (excluding Revolution Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						3143.17				
	Earnings Per Equity Share on net profit after tex (Fully paid-up equity share of Re. 104-each)										
	Besic: (t) Dibled: (t)	2.35 2.35	1.86 1.88	2.31 2.31	6.16 6.18	4.65 4.65	7.03 7.03				

1.	Key numbers of Unaudited Standalon	e Financial Re	cults: [Al	l amounts ar	e in lakha, u	niess other	wise stated.].					
			Standalone									
Par.			Quarter End	ed	Nine Mon	Year Ended						
	Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024					
PE)	-	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)					
1	Tumover (Revenue from operations)	38.08	37.87	34.43	111.05	91.79	127.87					
2	Profit Before Tex	22.25	20.84	91.36	64.14	312.46	335.17					
3	Profit After Tax	16.82	15.54	80.30	48.12	278.34	283.81					
2	The said results have been reviewed by the	Audit Committee	and approved	by the Board :	of Directors of	the Company	at its Meeting					

held on 13th February 2025. The above is an extract of the detailed format of Unexidited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed Financial Results are available on the website of the Stock Exchange at www.besindia.com and on the website of the Company at https://www.optimustinance.in/quality-

results-limited-review? The same can also be accessed by scanning the QR Code as provided below.

Date: 13.02.2025 Place: Vadodara



M/S NEOGROWTH CREDIT PRIVATE LIMITED **NEOGROWTH**

ending simplified. Growth empiried. Registered office: Times Square, Tower E, 9th Floor, Andheri Kurta Road, Marol, Andheri East-400059; T: 91 22 4921 9999 www.neogrowth.in CIN: U51504MH1993PTC251544

POSSESSION NOTICE - (for immovable property)

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the NeoGrowth Credit Private Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 and in exercise of powers conferred under section 13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 06.03.2024, cating Sunny Evergreen (Merchant), Nandial Bhojumal Lohana, Guddi Rani & Jaikumar Nandlal Lohana (Borrower/Co-Applicant/ Parlner/ Authorised Signatory), to repay the outstanding amount in the notice being as on 08.08.2024 an amount of Rs. 43.71,560.29/- (Rupees Forty Three Lakh Seventy One Thousand Five Hundred Sixty & Paise Twenty Nine Only) is due and payable by you under loan account No. 1252463, Rs. 21,68,061.13/- (Rupees Twenty One Lakh Sixty Eight Thousand Sixty One & Paise Thirteen Only) is due and payable by you under loan account No. 1255:157 and an amount of Rs. 16.91.171.00/- (Rupees Sixteen Lakh Ninety One Thousand One Hundred Seventy One Only) Is due and payable by you under loan account No. 1271904 Le. totaling to Rs. 82.30,792.42/-{Rugees Eighty Two Lakh Thirty Thousand Seven Hundred Ninety Two Paise Forty Two Only) along with interest, penal interest, charges, costs, etc within 60 days from the date of the said notice.

has taken physical possession of the property described herein view of order dated 21.12.2024, Passed by the Court of Honble Addl. Chief Metropolitan Magistrate, Ahmedabad City, Gujarat in Case No.15990/2024 through Mr. A.P. Chauhan, Assistant Superintendent of the Court/Court Commissioner and the said Court/Commissioner handed over the physical possession to the undersigned/ Authorized Officer on 09.02.2025

The borrower, having failed to repay the emount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured asse 5

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the NeoGrowth Credit Private Limited, for an amount of being an amount of Rs. 82,30,792 42/- (Rupees Eighty Two Lakh Thirty Thousand Seven Hundred Ninety Two Paise Fourty Two Only) is due and payable by you under loan account No. 1252463, 1255157 & 1271904, along with interest, inenat interest, charges, costs etc. from 08.08.2024.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Schedule - A All That Piace And Parcel of Property of Flat No. 401 On Fourth Floor of Block No. 'A', Admeasuring 94.98 Sq. Meters Carpet Area And. Admeasuring 9.07 Sq. Meters Balcony Area, Totally Admeasuring 104.05 Sq. Meters Alongwith Undivided Land Share Admeasuring 38.56 Sq. Meters In The Scheme Known As "SSD Heights Premium" Constructed On Land Bearing Final Flot No. 37 of Town Planning Scheme No. 97. Survey/block No. 214/2, Situated At Mouje Naroda, Taluka Asarva, Registration District Ahmedabad And Sup District Ahmedabad-6 (Naroda), Ahmedabed: 382340 Gujarat And Bounded By: East: Margin Space, West: LiftAnd Passage And Then Flat No. A/402, North: Flat No. A/404. South: Margin Space

Date: 09-02-2025 Place: Ahmedabad, Gujarat

Authorised Officer For Neogrowth Credit Private Limited

Authorised Officer

Manappurem Home Finance Ltd

* MANAPPURAM

MANAPPURAM HOME FINANCE LIMITED FORMERLY MANAPPURAM HOME FINANCE PVT LTD

CIN: U65923K12010PICO39179 Read Office: IV/470A (OLD) W/638A (NEW) Manappuram House Valapad Thrissut, Kerala 680567 Corp Office: Manappuram Home Finance Limited, Third Floor, Unit No. 301 to 315, A Wing, 'Kanaka Wall Street', Andheri-Kurla Road, Andheri East, Mumbai-400093, Maharashtra. Phone No.: 022-66211000, Website: www.manappuramhomefin.com

DEMAND NOTICE Whereas the Authorized Officer of Manappuram Home Finance Ltd., having our registered office at IV/470A (old) w/638A (new), Manappurare House, Valapad, Thrissur, Kerata-680567 and branches at various places in India (hereinafter referred to as "MAHORN") is a Company registered under the Companies Act, 1956 and a Financial Institution within the meaning of sub-clause (iv) of clause (m) of sub-section (1) of Section 2 of the Securitization and Reconstruction of financial Assets and Enforcement of Security Interest Act. 2002 (hereinafter referred so as the Act) read with Notification No. S.O. 3466 (E) dated 18th December, 2015

issued by the Govt. of India, Department of Financial Services, Ministry of Finance, New Delhi, inter alia carrying on business of advancing loans for construction and / or purchase of dwelling units and whereas the Borrower / Co-Borrowers as mentioned in Column No. 2 of the below mantioned chart obtained foan from MAHOFIN and whereas MAHOFN being the secured creditor under the SARFAESI Act, and in exercise of powers conferred under section 13(2) of the sald Act read with Rule 2 of the security interest (Enforcement) Fluies 2002, issued demand notice calling upon the Borrowers / Co-Borrowers as mentioned herein below, to repay the amount mentioned in the notices with further interest thereon within 60 days from the date of notice, but the notices could not be served upon some of them for various reasons. That in addition thereto for the purposes of information of the said borrowers enumerated below, the said borrowers are being informed by way of this public notice.

Sr. No.	Name Of The Sprower/ Co-Sorrower/Len/Brasch	Description Of Secured Asset in Respect Of Which interest Has Seen Created	Npa Data	Outs Of Molice Sent & Outstanding Amount
	Pruthaviraj Kasharam Gehiot Anilaben Prathaviraj Gehiot Piraben Jayeuhbhai Gehiot /www.peri.zonnzega/ Ahmedabad	Property Searing Sheet No. 7, Extent Of 46.33 Sq.mirs. Survey No. 9 Palid Of Kalol Sim, Kalol Nagarpalika Property No. 8/4/88, Witnin Kalol Sim, Taluk Kalol, Gandhinager Ossinict, Gujarzi-Pin Code: 382721. East-The Back Side Well Of The Property After That Road, West-The Main Door Of The Property After That Internal Road, South-Road, North-Property Bearing C.S.No. 180/A	G7-01-2025	09-01-2025 & Rp. 675366/-

total outstanding amount as shown herein above, against the respective Borrower / Co-Borrower, within 60 days of publication of this notice. Failure to make payment of the total outstanding amount together with further interest by the respective Borrower/ Co-Borrower, MAHOFIN shall be constrained to take u/s 13(4) for enforcement of security interest upon properties as described above. n for service of notice in other manners as prescri are put to notice that the said mortgage can be redeemed upon payment of the entire amount due together with costs, charges and expenses incurred by MAHOFIN at any time before the date of publication of notice for public auction or private treaty for transfer by way of sale, as detailed in Section 13(8) of the SARFAES! Act.

Take note that in terms of S-13 (13) of the SARFAESI Act, you are hereby restrained from transferring end/or dealing with the Secured Properties in any manner by way of sale, lease or in any other manner.

Date: 15" February 2025 Place: GULAPAT

AHMEDABAD STEELCRAFT LIMITED

CIN: L27109GJ1972PLC011500

Regd. Office: 213, Sakar -V, Behind Natraj Cinema, Ashram Road, Ahmedabad-380009, Gujarat Corporate Office: 16A/2151, 2nd Floor, Sector 16A, Vasundhara, Ghaziabad- 201012, Uttar Pradesh E-mail id: ascsteelad1@gmail.com | Website: www.steelcraft.co.in

							in Lakhs
EL.			Quarter End	ed	Nine Mon	ths Ended	Year Ended
SI-	Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31,12,2023	31.03.2024
***	-	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1,	Total income from operations (net)	6815.23	3843.11	6.47	10658.35	74.31	76.60
2.		22-27	4.474	44.5		William.	
	Exceptional and/or Extraordinary items)	617,94	153.19	(11.74)	770.83	(101.94)	(259.24)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional &/or Extraordinary items)	617,94	153.19	(11.74)	770.83	(101.94)	(259.24)
7	Net Profit / (Loss) for the period after tax	011.39	100,10	121.74	110.00	(101/94)	(429.44)
7.	(after Exceptional & or Extraordinary items)	568.59	153,19	(12.46)	721.48	(104,11)	(228.63)
5.		7,00,000			,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,		1000
	Income (after tax))	567.47	190.59	(10.54)	742.49	(60.48)	(186.90)
6,	Equity Share Capital	409.2	409,20	409.20	409.20	409.20	409.20
7.	Other Equity excluding Revaluation Reserva	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	1,901.97
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)						
	Basic:	13.9	3,74	(0.30)	17.63	(2.54)	(5.59)
	Diluted:	13.9	3.74	(0.30)	17.63	(2.54)	(5.59)

December 31, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the the website of the Company i.e. http://www.steelcraft.co.in and on the website of BSE Ltd (www.bseindia.com).



For, AHMEDABAD STEELCRAFT LIMITED

ROHIT PANDEY MANAGING DIRECTOR DIN: 03425671

JYOTI RESINS AND ADHESIVES LTD

(CIN:- L24229GJ1993PLC020879) Registered Office:-Survey No. 873, Opp.Anand Healthcare, Ranchhodpura Road,

Santei, Tal. Kalol, Gandhinagar, Gujarat, India, 382721. Website: www.euro7000.com | E-Mail: info@euro7000.com | Contact No.: +02764286327

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE THIRD QUARTER & NINE MONTHS, ENDED DECEMBER 31, 2024

wi.		The	ee Months 8	nded	Nine Mon	ths Ended	Year Ended
SI No.	Particulars	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
NUA	5/25/0-4/0-2/4-	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1	Total Income from Operations	7109.00	6525.00	6192.00	20552.00	18606.00	25730.00
2	Other Income	291.00	273.00	125.00	760.00	262.00	682.00
2	Net Profit/(Loss) from ordinary activities for the period (before tax, Exceptional and/or						
3	Extraordinary items) Net Profit/(Loss) from ordinary activities for the period before tax, (After Exceptional	2498.00	2176.00	2151.00	7175.00	6448,00	8960.00
	and/or Extraordinary items)	2498.00	2176.00	2151.00	7175,00	6448.00	8960.00
4	Net Profit/(Loss) from ordinary activities for the period after tax, (After Exceptional and/or Extraordinary items)	1906.00	1629.00	1644.00	5410.00	4835.00	6712.00
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive	20792	- Contract	lade dar		73-15/00	en 1944
	income (after tax))	1914.00	1629.00	1644.00	5435.00	4835.00	6746.00
6	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	1200.00	1200.00	1200.00	1200.00	1200.00	1200.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		-		à.		13744.00
8	Earnings Per Share (Face Value of Rs.1/- each)(not annualized)						13144.00
	a. Basic	16.00	14.00	14.00	45.00	40.00	56.00
	b. Diluted	16.00	14.00	14.00	45.00	40.00	56.00

1 The above Unaudited Financial Results of the Company for the quarter ended December 31, 2024 have been reviewed by the Audit

Committee and thereafter approved by the Board of Directors at their meeting held on January 30, 2025. 2 This Unaudited Financial Statements of the company for the quarter ended 31st December 2024 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind As), prescribed under section 133 of the Companies Act, 2013.

read with relevant rule issued thereunder and other accounting principles generally accepted in India. The Company's business activity falls within a single reportable business segment. Therefore segment reporting is not applicable.

4 The earning per share (EPS) are not assuratised for nine month ended on 31st December, 2024 & 31st December 2023 and for the quarter ended on 31st December, 2024; 30th September, 2024 & 31st December, 2023

5 The figures for the previous period/year have been regrouped /reclassified, wherever considered necessary. For, Jyoti Resins And Adhesives Ltd

Jagdishbhai Patel Chairman DIN: 00304924

financialexp.epapr.in

Dipak V. Raval (Whole time Director)

Ahmedabad

39.92.2028

(અનઓડિટેડ)

(4.08)

(4.08)

(4.08)

વર્ષનાં અંતે

39.92.2023

અનઓડિટેડ

0.03

0.03

0.03

0.03

બોર્ડ ઓફ્ર ડાચરેક્ટર્સ વતી અને માટે

વિશાલ કુમાર શમ

મેનેજિંગ ડાયરેક્ટર

તારીખ ૧૫.૦૨.૨૦૨૧

પટના ઇલેક્ટ્રીક સપ્લાચ કો.લી.

CIN:L40105WB1956PLC023307 રજી. ઓફીસ: 3 ખેત્રાદાસ લેન, પહેલો માળ, ૭લકત્તા– ૭૦૦૦૧૨ (પશ્ચિમ બંગાળ) ઇમેઈલ: pescico@gmail.com વેબસાઈટ : www.patnaelectricsupplycompany.com

૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને નવ માસિકના અનઓડિટેક નાણાંકિય પરિણામોના નિવેદનનો સાર

ત્રેમાસિકના અંતે

39.92.2028

(અનઓડિટેડ)

129.43

(5.84)

(5.84)

(5.84)

(0.62)

એ) સેબી (લિસ્ટીંગ અને અન્ય ડિસ્ક્લોઝર રીક્વચારમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોર્ સરોન્જોમાં ફાઈલ કરેલ ત્રિમાસિક નાણાંકિય પરિણામોની સંપુર્ણ માહિતીનો સાર ઉપર મુજબ છે. ત્રિમાસિક

નાણાંકિય પરિણામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એક્સચેન્જની વેબસાઇટો અને લીસ્ટેડ સંસ્થાની વેબસાઈટ www.patnaelectricsupplycompany.com . ઉપર ઉપલબ્ધ છે. બી) ૩૧ ડિસેમ્બર , ૨૦૨૪ના રોજપુરા થતાં ત્રિમાસિક અને નવા માસિક ના ઇન્ડએએસ અનુપાલિત નાણાંકિસ્

પરિણામોની ઓડિટ ક્મીટી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને કંપનીના બોર્ડ ઓફ ડાચરેક્ટર્સે ૧૪

ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ યોજાયેલ તેમની સંબંધિત બેઠકમાં મંજુર કર્યા હતાં.

motilal oswal

મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ

Home Finance CIN-U65923MH2013PLC248741 રજી. ઓફીસ : મોતીલાલ ઓસવાલ ટાવર, રહિમતુલાહ સાચાણી રોડ , પારેલ એસટી કિપોટ સામે , પ્રભાદેવી , મુંબઇ–૪૦૦૦૨૫. **ઇમેઇલ** : htquery@motilaloswal.com

ખાનગી સંધિ

રાજુ મિશરીલાલ પ્રસાદ

રૂમ નં. ૨૯, પ્લોટનં. ૧૦૫–૧૦૬, બળિયા દેવ મંદિર સામે , લસ્કાણા, સુરત , ગુજરાત–૩૯૫૦૦૬ શોપનં. ૨, ઉમિયા શોપિંગ સેન્ટર, ડાયમંડ નગર સામે, લસ્કાણા, કામરેજ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૬ મનુકુમાર મિશરીલાલ પ્રસાદ

3મ નં. ૨૯. પ્લોટનં. ૧૦૫–૧૦૬, બળિયા દેવ મંદિર સામે, લસ્કાણા, સુરત, ગુજરાત–૩૯૫૦૦૬ (અહી પછી એક સાથે દેવાદારો તરીકે દર્શાવેલ છે)

વિષય: લોન એકાઉન્ટ નં. LXSUR00215-160017338 મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ (અગાઉ એસ્પાયર હોમ ફાયનાન્સ કોર્પોરેશન લીમટીડ તરીકે જાણીતી, અહીં પછી એમઓએચએફએલ તરીકે દર્શાવેલ છે) (સિક્યોર્ડ લેશદાર) ને ગીરો કરાયેલ સિક્યોર્ડ એસેટ મિલકતના વેચાણ માટે ૧૫ દિવસની સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) હેઠળ પ્રી-સેલ નોટીસ

સિક્યોરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ડ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સટફ્રૈસી એક્ટ) ની ક્લમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ તારીખ ૨૪.૦૮.૨૦૨૫ ની બજવણીને અવગણીને, તમો ઉપરોક્ત દેવાદારો અને જામીનદારો માંગણાની રક્મ **રૂા. ૮૧૨૮૬૮/– (રૂપિયા આઠ લાખ બાર હજાર આઠસો અડસઠ પુરા)** જ્યાવેલ ૬૦ દિવસની અંદર ચુકવવામાં નિષ્ફળ ગયા છો અને આથી સિક્યોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ **પ્લોટ નં. ૧૫૭, ગ્રીન એવન્યુ, રેવન્યુ સર્વે નં. ૨૫૦-બી,** ૪૦-૧૫ થો.મી. ઉટિયાદરા ગોહુલાદામ રેસીડેન્સી, અંકલેશર, બરૂચ, ગુજરાત-૩૯૨૦૦૧ ની સિક્યોર્ડ મિલકતનો કબબો ૧૭.૧૦.૨૦૨૫ ના રોજ લઇ લીધો છે.

અમે સિક્યોર્ડ મિલકતના વેચાણ માટે જાહેર હરાજીઓ ચોજી હતી પરંતુ તમામ હરાજીઓ કોઈ બીડ ન મળત નિષ્ફળ ગઈ હતી. પરિણામે અમે ખાનગી સંધિના માર્ગે રિચોર્ડ મિલક્તનું વેચાણ કરવા માંગીએ છીએ. સિક્ચોર્ડ લેશદાટના પરામર્શથી ઉપરોક્ત સિક્ચોર્ડ મિલક્તના વેચાણ માટે **રીઝર્વ હિંમત રૂા. ૩૦૦૦૦૦/**-**(રૂપિયા ગણ લાખ પુરા)** નિયત કરાઈ છે. મિલકત પર સિક્યોર્ડ લેણદારની જાણકારી મુજબ કોઈ બોજો નથી. સિક્યોર્ડ મિલકતો પરત મેળવવા માટે પ્રાપ્ત સમયના સંબંધમાં સરફૈસી એક્ટની ક્લમ ૧૩ની પેટા ક્લમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારો અને જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

આ નોટીસ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સેએ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬)ના અનુપાલનમાં તમો સંબોધિતોને આપવામાં આવે છે અને આથી તમોને જાણકારી આપીને સુચિત કરવામાં આવે છે કે ઉપરોક્ત સિક્યોર્ડ મિલક્તો ખાનગી સંધિના માર્ગે આ નોટીસ થી ૧૫ દિવસ પુરા થયે **બીજો માળ, રોક ફોર્ડ બિઝનશ** સેન્ટર, **ઉદાના દરવાજા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત** ખાતે ૧૦.૦૩.૨૦૨૫ ના રોજ અથવા ત્યાર બાદ કોઈપણ અન્ય દિવસે ખાનગી સંધિ મારફત વેચવામાં આવશે.

બજાજ કાચનાન્સ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : બજાજ ફાથનાન્સ લીમીટેડ, પુણે**–અહે**મદનગર રોડ પડખે, વિમાન નગર, પુણે–૪૧૧૦૧૪ **શાખાનું સરનામું** : બજાજ ફાથનાન્સ લીમીટેડ ઓફીસ કપડવંજ–૩૮૭૬૨૦

સિક્યોર્ડ સ્થાવર

મિલકતની વિગત

પ્લોટ નં. એ/૮, શક્તિનગર, દેના બેંક પાસે, ફુલબાઇ માત

રોડ, કપડવંજ, તાલુકો–કપડવંજ, જિલો–ખેડા, ગુજરાત

उटरहरू तेमक झेमन सेटियानो न वहेंयायेल हिससो

(એરિયા ક્ષેત્રફળ ૨૩૦૯ ચો. કૂટ) ખાતેની મિલકતના તમામ

ભાગ અને હિસ્સા. **થતુઃસીમા** :

પુર્વ : સોસાચટીનો રોડ,

પશ્ચિમ : પ્લોટ નં. એ/પ

ઉત્તર : પ્લોટ નં. એ/૭.

મોતીલાલ ઓસવાલ હોમ ફાચનાન્સ લીમીટેડ

સિક્યોરીટાઈગ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૧ (એક્ટ) અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ (નિયમો) ની જોગવાઈઓ હેઠળ

મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ (એમઓએમએ) કએલ) ના નીચે સહી કરવાના, ૧૯૭૨ (જાનના) એક્ટ હેઠળ અને નિયમ 3 સાથે વંચાતી એક્ટર્ન કલમ ૧૩(૧૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને એક્ટરની કલમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસો જારી કરીને નીચેના દેવાદાર(રો) ને સંબંધિત નોટીસ(સો) માં

જણાવેલ ટકમ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુક્વવા જણાવ્યું હતું. નીચે સહી કરનાર કારણોસર માને છે કે દેવાદાર(રો) માંગણા નોટીસ(સો) ન બુજ્વણીને ટાળી રહ્યા છે, પરિણામે નિચમો મુજબ પ્રકાશન અને ચોટાડીને નોટીસની બજવણી કરવામાં આવી રહી છે. માંગણા નોટીસ(સો) ની વિગતોનો સાર અર્હ

માંગણાં નોટીસની તા**રીખ** અને ખાકી સ્ક્રમ

०६-०२-२०२५ ३।. ११२२६६४/-

(રૂપિયા અગિયાર લાખ બાવીસ હજાર

છસ્સો ચોસઠ પુરા)

0E-05-5054 31. 866055/-

(રૂપિયા ચાર લાખ નવાણું હજાર બાવીસ

પુરા)

પંચાવન પુરા)

०६-०२-२०२५ ३।. १०६*६७७७/-*

(રૂપિયા દસ લાખ ઓગણસીત્તેર હજા

સાતસો સીત્યોત્તેર પુરા)

०६-०२-२०२५ ३।. २५०००४०/-

(રૂપિયા પચ્ચીસ લાખ ચાલીસ પરા)

०६-०२-२०२**५ ३**।. २**१०६४८०/**-

(રૂપિયા એકવીસ લાખ છ હજાર ચારસો

એશી પુરા)

૧૨-૧૨-૨૦૨૫ **३**1.४૯૩૧૨४/-

(રૂપિયા ચાર લાખ ત્રાણ હજાર એક્સો

ચોવીસ પુરા)

આથી દેવાદાર(રો) ને માંગણા નોટીસ(સો) નું પાલન કરીને તેમાં જ્ણાવેલ અને અહીં ઉપર જ્ણાવેલ માંગણાની રક્મ આ પ્રકાશનની તારીખથી દ્દ૦ દિવસની અંદર ચૂકવણી

વુટદારાની તારીખ સુધી લાગુ ત્યાજ, વધારાના ત્યાજ, બાઉન્જ સાર્જિસ, ફોસ્ટ ગને ખર્ચ સહીત ચુકવવા સલાહ છે. દેવાદાર(રો) એ નોંધ લેવી કે એમ્બોપેનેઓફએલ સિક્લોર્ડ લેવદાર છે અને દેવાદાર(રો)એ મેળવેલ વોન સવલત દેવાદાર(રો) દ્વારા ગીરો દરાવેલ સિક્લોર્ડ એસેટ(ર) ની સ્થાવર મિલદત(મિલદત્તી સામે સિક્લોર્ડ જાણ છે. દેવાદાર(રો) જ્યાવેલ સમચગાળા દરમિયાન તેમની જ્વાબદારીઓ પુરેપુરી નિભાવામાં નિષ્ફળ જો તો, એમ્બોએચએફએલ એક્ટ અને તે હેઠળના નિચમે હેઠળ સિક્લોર્ડ મિલદત્ત(તો)નો કળજો તેવા સહીત પરંતુ વેચાણનાના માર્ગે તેની તબદલીની અથવા અન્ય ઉપલબ્ધ ઉપાયોનો ઉપયોગ કરવા સહીત એક્ટની દલમ ૧૩(૪) હેઠળ તમામ હોનો

ઉપયોગ કરવા હટદાર ગણાશે. એમઓએશએ ક્રમેલ વેશાશ, અથવા ચૂન્જાફરના હઠનો ઉપયોગ કરતા પહેલાસિકથોર્ડ મિલકત(તો) ટાંશમા લેવા અને/અથવા સીલ કરવાની પણ સત્તા ધરાવે છે. સિક્થોર્ડ મિલકત(તો)નું વેશાશ કર્યા પછી, જો ગૌરો મિલકતોની કિંમત એમઓએશએ ફએલને ચુકવવા પાત્ર ળાકી રકમની વસુલાત કરવા માટે અપુરતી છે, તો એમઓએશએફએલ બાકી રકનો વસુલાત રવવા માટે અલગ છનુની કાર્યવાહીઓ કરવાનો પણ હઠ ધરાવે છે. આ ઉપાય કોઈ અન્થ કાયદાઓ હેઠળ એમઓએશએ ફએલને ઉપલબ્ધ તમામ અન્ય ઉપાયો ઉપરાંતનો અને અલગ છે.

સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં, એક્ટની કલમ ૧૩(૮) ની જોગવાઇઓ પત્થે દેવાદારોનું ઘ્યાન દોરવામાં આવે છે અને વધુમાં એક્ટની કલમ ૧૩(૧૩) હેડળ, દેવાદારોને એમઓએચએફએલની આગોતરી લેખીત મંજુરી વગર સિક્ચોર્ડ મિલકત(તો)ની કોઈપણ વેચાણ, ભાડે અથવા અન્ય રીતે ટ્રાન્સફર કરવા અથવા સિક્ચોર્ડ મિલકત(તો) સાથે સૌદા કરવા અથવા નિકાલ કરવાની મનાઈ/પિલબંધ ફરમાવામાં આવે છે અને ઉપરોક્તનું ઉદ્દોદ્યન આ એક્ટની ક્લમ ૨૯ હેડળ ગુનો છે. માંગણ

નૌટીસની નક્લ નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે અને દેવાદાર(રો) જો ઈચ્છે તો, સામાન્ય ઓફીસના કલાકો દરમિયાન કોઈપણ ચાલુ દિવસે નીચે સહી કરનાર પાસેથી મેળવી

🛨 ભાગાંતરમાં ત્રુટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

રજી. ઓફીસ : મોતીલાલ ઓસવાલ ટાવર, રહિમૃતુલાહ સાચાણી રોડ,

એસટી ડિપોટ સામે, પ્રભાદેવી, મુંબઇ–૪૦૦ ૦૨૫, સીએસ : ૮૨૯૧૮૮૯૮૯૮

om **ខាមិនថា :** hfquery@mot

દક્ષિણ : પ્લોટ નં. એ/૧૬

· ભાષાંતરમાં ત્રુટી અથવા વિમંત્રતતા હવે તો અંત્રેશ સંમાણ માન્ય રહેશે. મોતીલાલ ઓસવાલ **હોમ ફાય**નાન્સ લીમીટેડ

દેવાદાર(સે)/ગીરવેદાર/જામીનદાર(સે) નું

નામ અને સરનામું લોન એકાઉન્ટ નંબર

શાખા : કપડવંજ ૧. મેસર્સ સહયોગ સેલ્સ કોર્પોરેશન જેના સીધા પ્રોપરાયટ ર

યોગેશકુમાર ગોવિંદભાશ પટેલ, સરનામું : ૦ સર્વે નં. ફ૭૯૨ એ વૈજનાથ મહાદેવ પાસે, અંતિસર ગેટ બહાર કપવંજ પેડા કપડવંજ-૩૮૭૬૨૦, ગુજરાત. દામેછલ : yogeshpatel2240@gmail.com સંપર્ક નં. : ૯૨૪૭૫૯૪૩૫

અહીં પર્ણ : પ્લોટ નં. એ/૮, શક્તિનગર, દેના બેંક પાસે, કુલબાઇ માતા રોડ,

માતાજી રો.ડ, કપડવંજ ખેડા, કપડવંજ–૩ેંટકફરંગ, ગુજરાત. ઇમેઇલ : yogeshpatel2240@gmail.com સંપર્ક : ૯૮૨૪૦પ૯૪૩૫ ૩. સો**ગેલફમાં આવિંકભાય પટેલ, સરનામું** : પદોટ નં. એ/૮, સક્તિનગર, દેના બેંક પાસે, કુલબાઇ માતા રોડ, કપડવંજ, તાલુકો–કપડવંજ, વિદ્યો–ખેડા,

ગુજરાત—૩૮૭૬૨૦, ઇમેઇલ : yogeshpatel2240@gmail.com સંપર્ક નં.

કપડવેજ, તાલુકો–કપડવેજ, જિલો–ખેડા, ગુજરાત–૩૮૭૬૨૦, ૨**. કપિલાખેન રામાભાષ્ટ્ર પટેલ, સરનામું :** એ/૮, શક્તિ નગર્ કુલબાઇ

P5R7PER8313452

२४०५८४ ३५

ાારીખ : ૧૪.૦૨.૨૦૨૫ સ્થળ : ગુજરાત

motilal oswal

લોન એગ્રીમેન્ટ નં. / દેવાદાસ(રો)/ સહ-દેવાદાર(સે)/ સહ-અસ્લ્દાર/જામીનદારનું નામ

LXSUR00417-180052055

LXKAD00217-180058581 /

સરસ્વતી કિશન નાયક

LXSUR00416-170033295 / Dilip રામાજ્ઞા થોર્થાસી / સંગીતાદેવી દિલીપ

LXADA00317-180057483 /

રાજેશબાઇ અનાતરા રાવલ /

LXMOSURA5522-230660288

સંજય દુર્ગા કોટકર /

રાપાલી સંજય કોટકર

LXMOAHMA5523-240702648

વિપુલકુમાર શ્રીમાળી / ડોલીબેન શ્રીમાળી

LXBOT00117-180055350

ઘનશ્યામભાઇ ખોડાભાઇ ખાડાસલિયા

તારીખ: ૧૫.૦૨.૨૦૨૫

વાસુભાઇ બેચરભાઇ ભરવાડ /

(અદિકૃત અદિકારી)

કળજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

(સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨નો નિયમ ૮ (૧) સાથે વંચાતા (૫રિશિષ્ટ ૪) મુજબ)

. દેવાદારો/ગીસવેદારો/જામીનદારો જણાવેલ સ્કમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદારો/ગીસવેદારો/જામીનદારો અને જાહેર જનાતને આથી જાણ કરવામાં આવે છે કે નીચે સહે જનારે સિક્યોરીટી ઇન્ડરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમદ સાથે વંચાતી કલમ ૧૩(૪) હેડળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને અહીં નીચે દર્શાવેલ મિલકતનો **સાંકેતિક કબ્જો** લ

ખાસ કરીને દેવાદારો અને જાહેર જ્વાતને આથી જણાવેલ મિલકતો સાથે લેઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો બજાજ ફાથનાન્સ લીમીટેડની અહીં ની:

જ્યાવેલ રડમ અને ઝરારના દરે વ્યાજના શાર્જને આદિન રહેશે. સિક્યોર્ડ મિલકતો પરત ચુલ્વવા માટે ઉપલબ્ધ સમયના સંબંધમાં એક્ટની કલમ ૧૩ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

માનું કે મેસર્સ બજાજ ફાયનાન્સ લીમીટેડ (બીએફએલ) ના નીચે સહી કરનાર અદ્યિકૃત અદ્યિકારીએ સિક્યોરીટાઇપ્રેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેટળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ 3 સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેટળ મળેલ સત્તાનો ઉપર લ્ટીને અહીં નીચે જ્યાવેલ દેવાદાર(રો))સ૯-દેવાદારોને જ્યાવેલ એક્ટની કલમ ૧૩(૨) ઢેડળની નોટીસમાં જ્યાવેલ ૨૯મ આ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જ્યાવ્યું :

motilal oswal

મોતીલાલ ઓસવાલ હોમ કાયનાન્સ લીમીટેડ

Home Finance CIN- U65923MH2013PLC248741 રજી. ઓફીસ : મોતીલાલ ઓસવાલ ટાવર , રેલ્મિતુલાહ સાચાણી રોડ , પારેલ એસટી કિપોટ સામે , પ્રભાદેવી , મુંબઇ–૪૦૦૦૨૫. **ઇમેઇલ** : hfquery@motilaloswal.com

ખાનગી સંધિ

જગજ્ઞાથ શ્રીગણપતી નાઉક ૫૫૨, જ્લારામ સોસાચટી, ગણેશપુરા હાઉસિંગ રોડ, અમરોલી, સુરત, ગુજરાત–૩૯૪૧૦૭ ગાચત્રી મોબાઈલ શોપ, બી–૬, દેવ દીપ સોસાચટી, ગણેશપુરા હાઉસિંગ બોર્ડ, અમરોલી, સુરત, ગુજરાત 368408 જય ગણપતી નાયક

૫૫૨, જ્લારામ સોસાચટી, ગણેશપુરા હાઉસિંગ બોર્ડ, અમરોલી, સુરત, ગુજરાત–૩૯૪૧૦૭ (અઠી પછી એક સાથે દેવાદારો તરીકે દર્શાવેલ છે)

વિષયઃ લોન એકાઉન્ટ નં. LXKAD00416-170035864 મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ (અગાઉ એસ્પાયર હોમ કાયનાન્સ કોર્પોરેશન લીમટીડ તરીકે જાણીતી. અહીં પછી એમઓએ થએ કએલ તરીકે દર્શાવેલ છે) (સિક્યોર્ડ લેશદાર) ને ગીરો કરાયેલ સિક્યોર્ડ એસેટ મિલકતના વેચાણ માટે ૧૫ દિવસની સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) હેઠળ પ્રી–સેલ નોટીસ

સિક્યોરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ડ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફૈસી એક્ટ) ની કલમ ૧૩(૨) હેઠળ મોંગણા નોટીસ તારીખ ૦૬.૦૮.૨૦૨૨ ની બજવણીને અવગણીને, તમો ઉપરોક્ત દેવાદારો અને જામીનદારો માંગણાની રક્મ રૂા. ૭૦૩૧૪૧/–/– (રૂપિયા જ નહાના અવગલાના, તમા ઉપલાસ દયાદારા અંગ ગામાં ગામાં ગામાં ભારાના કર્યું કર્યું. કાત લાખ ત્રણ જેજાર એક્સો એક્લાલીસ પુરા) જ્ણાવેલ દૃં ૦ દિવસની અંદર યુક્વવામાં નિષ્ફળ ગયા છે અને આથી સિક્સોર્ડ લેણદારના અધિકૃત અધિકારીએ પ્લોર **નં. ૧૩૯, ગ્રીન એવન્યુ, ઉઢિયાદરા રોડ,** ગો**લુલધા**મ રેસીડેન્સી પાસે, રેવન્થુ સર્વે નં. ૨૫૦-ળી, કોસંબા, ઝાંકલેશ્વર, સુરત, ગુજરાત-૩૯૪૧૨૦ ની સિક્યોર્ડ મિલકતનો કબજો ૨૮.૦૮.૨૦૨૩ના રોજ લઇ લીધો છે.

અમે સિક્સોર્ડ મિલકતના વેચાણ માટે જાહેર હરાજીઓ ચોજી હતી પરંતુ તમામ હરાજીઓ કોઈ બીડ ન મળતાં નિષ્ફળ ગઈ હતી. પરિણામે અમે ખાનગી સંધિના માર્ગે રિયોર્ડ મિલકતાનું વેચાણ કરવા માંગીએ છીએ. સિક્યોર્ડ લેણદારના પરામર્શથી ઉપરોક્ત સિક્યોર્ડ મિલક્તના વેચાણ માટે રીઝર્વ કિંમત રા. 300000/- (રૂપિયા ગણ લાખ પુરા) નિયત કરાઈ છે. મિલકત પર સિક્યોર્ડ લેણદારની જાણકારી મુજબ કોઈ બોજો નથી સિક્યોર્ડ મિલકતો પરત મેળવવા માટે પ્રાપ્ત સમયના સંબંધમાં સરફ્રૈસી એક્ટની ક્લમ ૧૩ની પેટા ક્લમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારો અને જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

આ નોટીસ સિક્યોટીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬)ના અન્પાલનમાં તમો રસંબોદિતાને આપવામાં આવે છે અને આશી તમોને જાણકારી આપીને સુધિત કરવામાં આવે છે કે ઉપરોક્ત રિક્યોર્ડ મિલકતો ખાનગી સંધિના માર્ગે આ નોટીસ થી ૧૫ દિવસ પુરા થયે ઓફીસ નં. ૨૧૪, ૩૧૪ માળ, શ્યામ આર્કેડ, બ્લોક નં. દૃદ્દ, પ્લોટનં. ૧થી દ્ર એ,બી,સી, મોદી હોસ્પિટલ, બારડોલી રોડ, મણીનગર, કાડોદરા, સુરત, ગુજરાત-૩૯૪૩૨૭ ખાતે ૧૦.૦૩.૨૦૨૫ના રોજઅથવા ત્યાર બાદ કોઈપણ અન્ય દિવસે ખાનગી સંધિ માર્ટફત

(અદિાકૃત આ મોતીલાલ ઓસવાલ હોમ કારાનાન્સ લીમીટેડ ભાષાંતરમાં તુરી અથવા વિશંગતતા હવે તો અંગ્રેલ સંક્રમણ માન્ય રહેવે.

B

FINANC

૧૩(૨) નોટીસ મુજબ તારીખ અન્ ૧૩(૨) નોટીસ મુજબ રહમ

કબઢાની પાડીમ

\$1. 2049.304.88/-

1909.9094

માંગણા

નોટીસ

સહી/– અધિકૃત અધિકારી ખજાજ ફાયનાન્સ લીમીટેડ

વિગત

૧૬૩,શિવ નગર,દાદા ભગવાન મંદિર પાછળ, કામરેજસૂરત ,દાદા

પ્લોટ નં. ૮૩, ગ્રીન એવન્થ, અટિચાદ્રા રોડ, ગોક્લદ્યામ રેસિડેન્સી

પાસે, કોસંબા, અંકલેશ્વર-૩૯૩૦૦૧, ભરૂચ, સુરત, ગુજરા

ાયણ નગર સુક્ટ ફેક્ટરી પાસે, ૩૯૪૧૩૦, સુરત, ગુજરાત માયણ નગર સુક્ટ ફેક્ટરી પાસે, ૩૯૪૧૩૦, સુરત, ગુજરાત

પ્લોટ નં. ૧૨૮, કાવ્યા રેસિડેન્સી, સ્વાગત સોસાયટી પાસે, તપોવન

કુલ પાસે,કિમ સુરત, સ્વાગત સોસાયટી, ૩૬૨૨૨૫, માંગરોળ

ફાઇનલ પ્લોટ નં. ૧૪૩/સી ૧૧૭૩૬ શો.મી. બ્લોક નં. ૫૧૪ સ્કીમ નં. દર, પ્લોટ નં. ૭૨, મહાદેવનગટ-૨, ડિંડોલી ગોડાદરા રોડ, ડિંડોલી, સુટત, આઇટીઆઇ ટ્રેલિંગ ઇન્સ્ટીટ્યુટ પાછળ, મૌલી હોસ્પિટલ પાછળ-૩૯૪૨૧૦, સુરત, ગુજરાત

પ્લોટ નં. ૨૫. તમામ એરિયા લંબાઇ ૧૨.૮૦ મીટર. પહોળો મીટર

૩.૬૫ ચો.મી. ૪૬.૭૨ ચો.મી. સિદ્ધિ વિનાયક સોસાયટી, સિદ્ધરાથ

ોમ્સ પાસે, આરસોડિયા ક્લોલ ૦ ૦ સિલ્દ્રરાજ હોંગ

ા૦૬ પૈકી એક્ટ ૧–૦૦ ગુંથા, પ્લોટ નં. ૪ પૈકી પુર્વ બાજુ જમીન

રેસિડેન્સીય હેતુની સાલંગપુર રોડ, ગામ–સેથાલી, જિલો

₋₋₋₋ પાસે,૩૮૨૭૨૧ ક્લોલ, ગાંધીનગર, ગુજરાત

૩૬૪૭૧૦ ભાવનગર ગુજરાત.

મગવાન મંદિર ૩૯૪૧૮૦ સુરત, ગુજરાત

૦૬–૦૨–૨૦૨૫ રૂ.૧.૧૦૦૦૭૫૫/– પ્લોટ નં. ૭૬, સિલ્ફિટ સિડેન્જરી સેક્ટર નં. ૧, સેક્ટર નં. ૩, ટેવન્જ (રૂપિયા દસ લાખ સીત્યોત્તેટ હન્નર ત્રણસો અગ્રત સામામાં સિંહ્યો ટેડ ૦, અનારાજ સેક્સ્મારાલ માર્ક માલાલ માર્ક માલાલ

જુનાગઢ, ગુજરાત

motilal oswal

મોતીલાલ ઓસવાલ હોમ કાયનાન્સ લીમીટેડ

Home Finance CIN-U65923MH2013PLC248741 **રજી. ઓફીસ** : મોતીલાલ ઓસવાલ ટાવર, રહિમતુલાહ સાચાણી રોડ, પારેલ એસટી

ડિપોટ સામે, પ્રભાદેવી, મુંબઇ–૪૦૦૦૨૫. **ઇમેઇલ** : hfquery@motilaloswal.com ખાનગી સંધિ

તારીખ: ૧૫.૦૨.૨૦૨૫ **મોહમદ હનીફ અષ્તરભાઇ સૈયદ,** દ્ર3, ક્ટસનવાડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે, ઉમરવાડા રોડ, અંક્લેશ્વર

સુટત, ગુજરાત-૩૯૩૦૦૨ **મેસર્સ આર્યું સોડા સેન્ટર,** દૃ/૧૯**૭૪**૧૨, ભાટવાડ, ગોચા ભજાર રોડ, અંક્લેશ્વર, ભસ્ય, ગુજરાત-૩૯૩૦૦ **મિનાજબીબી હનીફ સેયદ,** દુ૩, કરસનવાડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે, ઉમરવાડા રોડ, અંકલેશ્વર, સુરત

(અહી પછી એક સાથે દેવાદારો તરીકે દર્શાવેલ છે) વિષય: લોન એકાઉન્ટ નં. LXKAD00316-170040388 મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ

અગાઉ એસ્પાયર હોમ ફાયનાન્સ કોર્પોરેશન લીમટીડ તરીકે જણીતી, અહીં પછી એમઓએચએફએલ ારીકે દર્શાવેલ છે)(સિક્ચોર્ડ લેણદાર) ને ગીરો કરાયેલ સિક્ચોર્ડ એસેટ મિલકતના વેચાણ માટે ૧૫ દિવસની સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(દ) હેઠળ પ્રી–સેલ નોટીસ.

भिड्योग्रीयर्घ प्रेशन सने बीहन्नर हशन ओह हारानान्त्रियाय सेनेरस सने सेन्होर्स हर ओह सिड्योग्रीरी ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફ્રેસી એક્ટ) ની ક્લમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ તારીખ ૦૬.૦૬.૨૦૨૩ની બજવણીને અવગણીને, તમો ઉપરોક્ત દેવાદારો અને જામીનદારો માંગણાની રકમ રૂા. ૧૦૨૩૫૩૫/– (રૂપિયા દશ લાખ તેવીસ હજાર પાંચસો પાત્રીસ પુરા) જણાવેલ ૬૦ દિવસની અંદર ચુકવવામાં નિષ્ફળ ગયા છો અને આથી સિક્સોર્ડ લેશદારના અધિકૃત અધિકારીને પ્લોટ નં. ૧૫૧, રેવન્યુ સર્વે નં. ૨૫૦–ળી, ગ્રીન એવન્યુ ઉદિચાદરા રોડ, ગોકુલદાન રેસીડેન્સી પાસે, કોસંબ, અંકલેશ્વર, ભરૂચ, સુરત, ગુજરાત–૩૯૪૧૫ની સિક્યોર્ડ મિલકતનો કંબજો ૧૭.૦૩.૨૦૨૫ના રોજ લઈ લીધો છે.

મમે સિક્ચોર્ડ મિલકતના વેચાણ માટે જાહેર હરાજીઓ ચોજી હતી પરંતુ તમામ હરાજીઓ કોઈ બીડ ન મળતાં નિષ્ફળ ગઇ હતી. પરિણામે અમે ખાનગી સીધીના માર્ગે રિયોર્ડ મિલકતનું વેચાણ કરવા માંગીએ છીએ. સિક્યોર્ડ લેણદારના પરામર્શથી ઉપરોક્ત સિક્યોર્ડ મિલકતના વેચાણ માટે રીઝર્વ કિંમત રૂા. 30000/– (રૂ પિયા ત્રણ લાખ પુરા) નિયત કરાઈ છે. મિલકત પર સિક્યોર્ડ લેણદારની જાણકારી મુજબ કોઈ બોજો નર્થ સિક્ચોર્ડ મિલકતો પરત મેળવવા માટે પ્રાપ્ત સમચના સંબંધમાં સર ફૈસી એક્ટની ક્લમ ૧૩ની પેટા ક્લમ (૮)ની ાગવાઈઓ પ્રત્યે દેવાદારો અને જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

આ નોટીસ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬)ના અનુપાલનમાં તમો . મંબોંધિતોને આપવામાં આવે છે અને આથી તમોને જાણકારી આપીને સુચિત કરવામાં આવે છે કે ઉપરોક્ત સિક્સોર્ડ મિલકતો ખાનગી સંધિના માર્ગે આ નોટીસ થી ૧૫ દિવસ પુરા થયે ઓફીસ નં. ૨૧૪, ૩જો માળ શ્યામ આર્કેડ, બ્લોક નં. દૃદ્દ, પ્લોટનં. ૧ થીદ્દ એ,બી,સી, મોદી ક્ષેસ્પિટલ, બારડોલીરોડ, મણીનગર, કાડોદરા સુરત, ગુજરાત-૩૯૪૩૨૭ ખાતે ૧૦.૦૩.૨૦૨૫ના રોજ અથવા ત્યાર બાદ કોઈપણ અન્ય દિવસે ખાનગી સંધિ મારકત વેચવામાં આવશે.

(અદિકૃત અદિકારી) ± ભાર્ષાતરમાં તુરી અથવા વિમંત્રતતા હવે તો અંગ્રેલ મંત્રલણ માન્ય રહેશે. ગોતીલાલ ઓસવાલ હોગ ફારાનાન્સ લીગીટેડ

motilal oswal

ાળાનો ચોખ્ખો નકો/(તોટો)

ફો/(તોટો)(અપવાદરૂપ અને/અથ

વેરા પછી ગાળાનો ચોખ્ખો નફો/(તોટો)

ગાળાની કલ સંચક્ત આવક (ગાળાના

ોરા, અપવાદરૂપ અને/અલ

ાસાધારણ ચીજો પહેલા)

ટા પૂર્વે ગાળાનો ચોખ્ખો

ાસાધારણ ચીજો પછી)

ઝપવાદર**પ અને/અ**થવ

ાફા/(તોટા)(વેરા પછી)

ાન્ય સંયુક્ત આવક

(વેરા પછી) સહીત

ક્લિટી શેર મુડી

(પ્રતિદિઠ રૂા. ૫/–ની)

શેર દીઠ કમાણી

તારીખ: ૧૪/૦૨/૨૦૨૫

. ાટારેલી

મોતીલાલ ઓસવાલ હોમ કાયનાન્સ લીમીટેડ

Home Finance CIN-U65923MH2013PLC248741 **રજી. ઓફીસ** : મોતીલાલ ઓસવાલ ટાવર, રહિંમતુલાહ સાચાણી રોડ, પારેલ એસટી ડિપોટ સામે, પ્રભાદેવી, મુંબઇ–૪૦૦૦૨૫. **છમેઇલ** : htquery@motilaloswal.com

ખાનગી સંધિ

કૈલાશ સુધાકરભાઈ ગરકે

સર્વે નં. ૧૦૧/૨/૧, પ્લોટનં. ૭૪, વિભાગ–૨, જ્થશિવમ કો.હા.સો.લી., સિંગાનપોટ ચાર રસ્તા, મલ્ટી પરપઝ હોલ સામે, વેદ રોડ, સુરત, ગુજરાત–૩૯૫૦૦૧

૧૦૪,બ્લુ ડાચમંડ બિલ્ડીંગ, નંદુ દોધી ની વાડી, ક્તારગામ, સુરત, ગુજરાત–૩૯૫૦૦૪ સુનંદાબેન સુધાકર ગરકે

સર્વે નં. ૧૦૧/૨/૧, પ્લોટનં. ૭૪, વિભાગ–૨, જ્યશિવમ કો.હા.સો.લી., સિંગાનપોટ ચાર રસ્તા, મલ્ટી પરપઝ હોલ સામે, વેદ રોડ, સુરત, ગુજરાત–૩૯૫૦૦૪

(અહીં પછી એક સાથે દેવાદારો તરીકે દર્શાવેલ છે) વિષય: લોન એકાઉન્ટ નં. LXSUR00217-180057440 મોતીલાલ ઓસવાલ હોમ કાયનાન્સ લીમીટેડ (અગાઉ એસ્પાયર હોમ ફાયનાન્સ કોર્પોરેશન લીમટીડ તરીકે જાણીતી, અહીં પછી એમઓએ થએ ફએલ તરીકે

દર્શાવેલ છે) (સિક્યોર્ડ લેશદાર) ને ગીરો કરાયેલ સિક્યોર્ડ એસેટ મિલકતના વેચાણ માટે ૧૫ દિવસને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) હેઠળ પ્રી–સેલ નોટીસ શ્રીમાન/શ્રીમતી. સિક્યોરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ડ ઓફ સિક્યોરીર્ટ

ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફૈસી એક્ટ) ની ક્લમ ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ તારીખ **૨૩.૧૨.૨૦૨૦** ની બજવણીને અવગણીને, તમો ઉપરોક્ત દેવાદારો અને જામીનદારો માંગણાની રક્મ **રૂા.** *૭***૯૬૪૮૪/– (રૂપિયા** <mark>સાત લાખ છક્ષું હજાર ચારસો ચોર્ચાસી પુરા)</mark> જ્યાવેલ ૬૦ દિવસની અંદર ચુક્વવામાં નિષ્ફળ ગયા છો અને સારા લાગ કર્યું કે. આશી સિક્યોર્ડ લેશદારના અધિકૃત અધિકારીએ <mark>પ્લોટ નં. ૩, ગ્રીન એવન્યુ, રેવન્યુસર્વે નં. ૨૫૦/બી, ખા</mark>તા નં. ૪૧, ઉટિયાદરા, અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત–૩૯૪૧૧૫ ની સિક્યોર્ડ મિલકતનો કબજો ૧૯,૦૧,૨૦૨૨ ના

અમે સિક્ચોર્ડ મિલક્તના વેચાણ માટે જા<mark>હેર હરાજીઓ ચોજી</mark> હતી પરંતુ તમામ હરાજીઓ કોઈ બીડ ન મળતાં નિષ્કળ ગઈ હતી. પરિણામે અમે ખાનગી સંધિના માર્ગે સિક્યોર્ડ મિલકતનું વેચાણ કરવા માંગીએ છીએ સિક્યોર્ડ લેશદારના પરામર્શથી ઉપરોક્ત સિક્યોર્ડ મિલક્તના વેચાણ માટે **રીઝર્વ કિંમત રૂા. ૩૦૦૦૦૦/**– (રૂ **પિયા ત્રણ લાખ પુરા)** નિયત કરાઈ છે. મિલક્ત પર સિક્ચોર્ડ લેણદારની જાણકારી મુજબ કોઈ બોજો નથી. સિક્યોર્ડ મિલકર્તો પરત મેળવવા માટે પ્રાપ્ત સમયના સંબંધમાં સરફૈસી એક્ટની ક્લમ ૧૩ની પેટા ક્લમ (૮)ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારો અને જામીનદારોનું ધ્યાન દોરવામાં આવે છે.

આ નોટીસ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ (૬)ના અનુપાલનમાં તમો . ાંબોંધિતોને આપવામાં આવે છે અને આથી તમોને જાણકારી આપીને સુચિત કરવામાં આવે છે કે ઉપરોક્ત સિક્યોર્ડ મિલકતો ખાનગી સંધિના માર્ગે આ નોટીસ થી ૧૫ દિવસ પુરા થયે **બીજો માળ, રોક ફોર્ડ બિઝનશ** સેન્ટર, ઉદ્યાના દરવાના, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત ખાતે ૧૦.૦૩.૨૦૨૫ ના રોજ અથવા ત્યાર બાદ કોઈપણ અન્ય દિવસે ખાનગી સંધિ મારફત વેચવામાં આવશે.

(અદિાકૃત અદિાકારી) ± ભાષાંતરમાં તુર્દી અથવા વિસંગતતા હવે તો અંગ્રેલ મંક્કરણ માન્ય રહેવે. મોતીલાલ ઓસવાલ હોમ ફાચળાન્સ લીમીટેડ

ઓપ્ટિમસ ફાયનાન્સ લીમીટેડ OPTIMUS

રજી.ઓફીસ: ૫૦૪એ, ઓઝોન, ડો.વિક્રમ સારાભાઇ માર્ગ, વાડી-વાડી, વડોદરા–૩૯૦૦૦૩ . ફોન–૦૨૬૫–૨૩૨૫૩૨૧ | વેબસાઇટ: www.optimusfinance.in | ઈમેઈલ: info@optimusfinance.in

3૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પુરા થતાં ત્રીજા ત્રિમાસિક અને નવ માસિકના સંયુક્ત અનઓડિંટેડ નાણાંકિય પરિણામોનો સાર (તમામ ૨૭મો લાખમાં છે, અન્યથા જણાવ્યા સિવાય)

3							
\$7	C>	6	ામસિકના અંદે	ì	વવા મારિ	વર્ષનાં અંતે	
d,	વિઝતો	31.12.2024	30.09.2024	31.12.2023	31.12.2024	31.12.2023	31.03.2024
		(અનમોડિટેડ)	(અનમોડિટેડ)	(અન્ક્યોડિટેડ)	(अन्सोडिटेड)	(અનમોડિટેક)	(ઓડિટેડ)
1	કામકાજોમાંથી કુલ આવક (સોષ્થ્મી)	3891.21	3658.79	2635.78	11450.89	7314.33	11418.08
2	ગાળાનો સોમ્મ્મો નફ્સે /(તોટો)(વેરા, અપવાદકૃપ અને/અથવા અસાધારણ સીજો પહેલા)	343.58	278.54	310.14	886.72	601.29	918.05
3	ોરા પૂર્વે ગાળાનો ચોખ્ખો નફો / (તોટો) (અપવાદરૂપ અને/અક્ષવા અસાધારણ રીજો પછી)	343.58	278.54	310.14	886.72	601.29	918.05
4	વેરા પછી આળાનો સોમ્મ્મો નફ્તે / (તોટો) (અપવાદરૂપ અને/અક્ષવા અસાધારણ રીજો પછી)	295.91	229.43	268.38	753.67	540.03	822.33
5	ાળાની કુલ સંઘુક્ત આવક	393.76	247.71	228.10	889.64	455.09	887.94
6	ર્શક્લિટી શે≥ મૂડી (મુળકિંમત શેર્સ્ટીઠ રૂા. ૧૦/−)	747.23	747.23	747.23	747.23	747.23	747.23
7	ઝાનામતો (પુર્નેમુલ્ઘોઉન્ત અનામતો શિવાદ્યની) પાછલા વર્ધના ઓક્ટિટેડ સરવૈશામાં દર્શાલ્યા મુજબ		_	_		_	3143.17
8	લેટા પછી ચોષ્મા ળફ્ત પર ઇક્વિટી શેર દીઠ કમાણી (પ્રતિદિઠ સ. ૧૦/–ની પુરેપુરી ભરપાઇ થયેલ ઇક્વિટી શેર મુકી)						
	મુળ: (રૂા)	2.35	1.86	2.31	6.16	4.65	7.03
	घयडेबी : (३).)	2.35	1.86	2.31	6.16	4.65	7.03
	4	2.35		2.31 (ਕਸ਼ਸ	6.16		आच्य
				ord	(पटा		

નવ માસિકના સાંતે ત્રિમાસિકના અંતે 31.12.2024 30.09.2024 31.12.2023 31.12.2024 31.12.2023 31.03.2024 තෝයිද්ය) (නංතෝයිද්ය) (නංතෝයිද්ය) (නංතෝයිද්ය) (නංතෝයිද්ය) (અ)ડિરેડ) 1 ટર્ન ઓવર (કામકાજમાંથી આવક) 38.08 34.43 111.05 91.79 37.67 2 ઘેરા પુર્વે નફો 22.25 20.84 91.36 64.14 312.46 335.17 16.82 15.54 80.30 48.12 278.34 3 લેટા પછી નફો ર. ઉપસેક્ત પરિણામોની ઓડિટ કમીટી દ્વાસ સમીક્ષા કરાઈ હતી અને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરોં ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજયોજાયેલ તેમની

બેઠકમાં મંજુર કર્યા હતાં 3. સેબી (લેસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને હિસ્કબોઝર રીક્વાચરમેન્ટ્સ) નિચમનો, ૨૦૧૫ના વિચમન ૩૩ હેઠળ સ્ટોક એક્સ્સેન્જમાં ફાઈલ કરેલ ઝનઓડિટેડ નાણાં ક્રિય પરિલામોની લે ગતાવાર માહીતીનો સાર ઉપેર છે. લિગતવાર નાણાં ક્રિય પરિલામો કંપનીની સ્ટોક એક્સ્સ્રેન્જની વેબસાઈટ www.bseindia.com અને કંપનીની લેબસાદીર https://www.optimusfinance.in/quality-results-limited-review/ ઉપર ઉપલબ્દ છે. તે નીરો આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ મેળવી શકાશે.

તારીષા: ૧૩.૦૨. ૨૦૨૫

ઓપ્ટિમસ ફાયનાન્સ લીમીટેક વર્તી દિપક વી રાવલ (સંપુર્ણ – સમયન। કાયરેક્ટર)

રાજકોટ ઇન્વેસ્ટમેન્ટ ટ્સ્ટ લીમીટેડ KSLS E ઉપર C... CIN :L65910GJ1982PLC005301 રજીસ્ટર્ક ઓફીસ : પરદ્દ, સ્ટાર ગ્રેખમર્સ, હરિહર ગ્રાંક, રાજકોટ, ગુજરાંત, રૂદ્દ ૦૦૦૧ કોર્પોરેટ ઓફીસ : એમ-૨૩ ગ્રુપર ટેક્સ રાવદ, ઉત્ત્રી ટોકીઝ સામે, રૂંગ ગ્રેક, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત, ભારત મેઇલ: rajketitita@gmail.com વેબસાઇટ : www.rtt.co.in મી. ન +૯૧-૮૧૨૮૧૭૨૫૨૧

ત્રિમાસિકના અંતે છમાસિકના અંતે વર્ષના અંતે 34.45.5058 30 06 5058 34 45 505 34,45,5058 34,45,505 34,03,2021 **નઓ**કિટેક નઓક્રિટેક અનઓક્રિટેક ગઓક્રિટેક ર અનઓકિટે: ઓક્ટિક કામકાજમાંથી કુલ આવક (ચોખ્ખી) 23.03 22.74 5.5B 68.31 8.34 43.77 ગાળાનો ચોખ્ખો નફો/(તોટો) વેરા ઝપવા**રૂપ અને/અથવા અસાધા**રણ 9.87 (12.03)12.97 3.0 વેરા પુર્વે ગાળાનો ચોખ્ખો નફો/(તોટો) અપવાદરૂપ અને/અથવા અસાધારણ ચીજો પછી) (12.03)12.97 3.07 8.27 (9.76)9.87 तेश प्रस्ती आणानी शोफ्सो न स्रो((तोश) મુપવાદરૂપ અને/અથવા અર 12.97 (12.03)3.07 8.27 (9.76)5.50 ગાળાની કલ વ્યાપક આવક ગાળાના નફા/(તોટા) (વેરા પછી) ઝ**ને અન્ય** વ્યાપક આવક (વેરા પછી) सहीत) (12.03) 12.97 3.07 8.27 (9.76)5.50 ઇક્લિટી શેર મુડી 100.00 100.00 100.00 100.00 100.00 100.00 અન્ય ઇક્વિટી પુર્ન મુલ્યાંકિત અનામતો શેર દીઠ કમાણી (પ્રતિદિઠ રૂા. ૨/–ની) (ચાલુ અને બંધ કામકાજો માટે)

નોંદ્ર : સેબી(લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને કિસ્ક્લોઝર રીકવાચરમેન્ટસ)નિચમનો, ૨૦૧૫ ના નિચમન ૩૩ <u>હે</u>ઠળ સ્ટોક એક્સચેન્જમા ફાઇલ કરેલ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજપુરા થતાં ત્રિમાસિક અને નવ માસિકના અન—ઓડિટેડ નાણાંકિય પરિણામોની વિગતવાર માહિતીનો સાર ઉપર મુજ્બ છે. ત્રિમાસિક ગાળાના નાણાંકિચ પરિણામોની સંપૂર્ણ માહિતી કંપનીની વેબસાઇટ એટલે કે www.ritl.co.ir અને બીએસઇ લીમીટેડની વેબસાઇટ (www.bseindia.com) ઉપર ઉપલબ્ધ છે. **રાજકોટ ઇન્વેસ્ટમેન્ટ ટ્સ્ટ લીમીટેડ વતી**

1.30

1.30

0.3

0.31

0.83

0.83

સહી/- વિનય ત્રિપાઠી

(મેનેજિંગ ડાયરેક્ટર)

તારીખ : ૧૪.૦૨.૨૦૨૫ સ્થળ : સુરત

. ઘટાડેલી:



(1.20)

(1.20)

શ્રીક્રિષ્ના બાબુસમ પાંડે મેનેજિંગ ડાયરેક્ટર (ડીઆઇએન : ૦૭૦૩૫૭૬૭)

(0.98)

0.55

0.55

એક્ચુરસી શીપીંગ લીમીટેડ

મોતીલાલ ઓસવાલ હોમ ફાયનાન્સ લીમીટેડ

CIN:L52321GJ2008PLC055322

એએસએલ હાઉસ, સર્વે નં. ૪૨ પ્લોટ નં. ૧૧, મેઘપર બોરીચી, અંજાર–૩૭૦૧૧૦, કચ્છ, ગુજરાત, ભારત. ઇમેઇલ: investor@aslindia.net 3૧ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને નવ માસિક અન–ઓડિટેડ નાણાંકિય પરિણામોનો સાર

અદિાકૃત અદિ

ક્રમ વિગત અલગદા સં						æ(+	યુ હ ત						
٥İ.	140101	ત્રિમાસીક ગાળાનાં અંતે			નવ મા	સના અંતે	વર્ષાતે		ત્રિમા સીક ગાળાનાં અં	લે	નવ મા	સના અંતે	વર્ષાતે
		39.9૨.૨૦૨૪ (અનસોડિટડ)	30.06.૨ ૦૨૪ (અનસોડિટેડ)	૩૧.૧૨.૨૦૨૩ (અનઓડિટેડ)	૩૧.૧૨.૨૦૨૪ (અનઓડિટેડ)	૩૧.૧૨.૨૦૨૩ (અનમોડિટેડ)	4505. E0. PE 25 2016	39.9૨.૨૦૨૪ (અનસોડિટેડ)	¥કળક. આ દ (સ્ક્રીર્દોલભાઇ)	૩૧.૧૨.૨૦૨૩ (અન્મોડિટેડ)	39.9૨.૨૦૨૪ (અનઓડિટેડ)	39.9૨.૨૦૨૩ (અનઓડિટેડ)	¥505. €0. PE 25 Elli€
٩	કામકાજમાંથી કુલ આવક	2,535.28	2,535.13	1,855.71	7,093.91	5,337.41	7,056.26	2,544.25	2,535.19	1,874.70	7,103.34	5,375.62	7,089.60
5	ગાળાનો ચોખ્ખો નફો/(તોટો) (વેરા,અપવાદરૂપ અને/અથવા અસાધારણ ચીજો પહેલા)	12.44	9.35	(19.75)	57.95	(79.70)	3.47	14.32	9.03	(19.72)	58.96	(78.19)	4.26
3	વેરા પુર્વે ગાળાનો ચોખ્ખો ન ફો /(તોટો) (અપવાદરૂપ અને/અથવા અસાધારણ રીજો પછી)	12.44	9.35	(19.75)	57.95	(79.70)	3.47	14.32	9.03	(19.72)	58.96	(78.19)	4.26
2	વેરા પછી ગાળાનો રોખ્ખો નફો/ (તોટો) (અપવાદરૂપ અને/અથવા અસાધારણ રીજોપછી)	8.42	4.39	(28.90)	38.12	(88.35)	4.62	9.71	4.35	(28.88)	38.81	(86.54)	4.97
ч	ાળાની ફુલ સંયુક્ત આવક (ગાળાનો નફો/(તોટો)(વેરા પછી)અને અન્ય સંયુક્ત આવક (વેરા પછી)	0	0	0	0	0	0	0	o	0	0	0	0
8	ઇક્વિટી શેર મુડી	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56	150.56
9	અનામતો (પુર્નમુલ્યાંહિત અનામતો સિવાયની) પાછલા વર્ષના ઓડિટેડ સ્ટચૈયામાં દર્શાવ્યા મુજબ						1,002.86		-				1,010.81
c	શેર દિઠ કમાણી (પ્રતિદિઠ ગ્ર. ૧૦/–ની) (ચાલુ અને બંધ લમલજોમાટે) ૧. મુળ	0.06	0.03	-0.19	0.25	-0.59	0.03	0.06	0.03	-0.19	0.19	-0.58	0.03
	ર. ઘટાડેલી	0.00	0.03	-0.19	0.20	-0.59	0.03	0.06	0.03	-0.19	0.19	-0.58	0.03

એ. ઉપસેક્ત ત્રિમાસિક અને નવ માસિક પરિણામોની ઓડિટ કમીટી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને બોર્ડ ઓફ્ડ ડાયરેક્ટર્સે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ યોજાયેલ તેની બેઠકમાં તેને રેકોર્ડ પર લીધા હતાં. બી. ઉપરોક્ત ઓડિટેડ નાર્ણાકિય નિવેદનો કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૩૩ માં જણાવાયેલ ઇન્ડિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ મુજબ અને તેના સંબંધિત નિયમો અને સેબી (લિસ્ટીંગ ઓબ્લી ગેશન્સ અને ડિસક્લોઝર રીક્લાયરમેન્ટ્સ) નિયમનો , ૨૦૧૫ના નિયમન 33 મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.

સી. કંપની ત્રણ વ્યવસાયિક ક્ષેત્રો એટલે કે લોજીસ્ટીક્સ સર્વિસ પ્રદાતા , પેટ્રોલિયમ અને મોટર વ્હીક્લ્સના વેચાણમાં સંકળાયેલ છે.

ડી. આંકડાઓ જ્યાં જરૂર જણાઇ ત્યાં પુર્નવર્ગીકૃત/પુર્નગઠિત કરવામાં આવ્યા છે.

ઇ. સેળી (લિસ્ટીંગ અને અન્ય ક્સિક્લોઝર રીક્લાયરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સરોન્જોમાં ફાઇલ કરેલ ગ્રિમાસિક અને નવ માસિક નાણાંક્ચિ પરિણામોની વિગતવાર માહીતીનો સાર ઉપર મુજળ છે. ગ્રિમાસિક અને નવ માસિક નાણાંક્ચિ પરિણામોની સંપુર્ધ માહીતી સ્ટોક એક્સરેન્જ(જો) ની વેબસાઇટો અને કપનીની વેબસાઇટ WWW.aslindia.net પર ઉપલબ્ધ છે. એક્યુરસી શીપીંગ લીમીટેડ

સ્થળ: અંજાર તારીખ: ૧૪.૦૨.૨૦૨૫

દિપ પોલીમર્સ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ: બ્લોક નં. ૭૨૭ અને ૫૫૩, ૨૬નપુર (સાંતેજ), તાલુકો: ક્લોલ, ગાંધીનગર–૩૮૨૭૨૧ **ઇમેઇલ:** info@deeppoly.com **વેબ સાર્ઘટ:** www.deeppoly.com ટેલી: +૯૧–૨૭૬૪–૨૮૬૦૩૨

૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને નવ માસિક ગાળાના અન ઓડિટેડ સંચુક્ત નાણાંક્ચિ પરિણામોનું નિવેદન

			(રૂા. લાખમાં, ઈ	પીએસ અને ર	મન્દાશા હાા	વ્યા સિવાય)
중시	વિગતો		ત્રિયાસિકના અંત	.ì	નવા મારિ	કના અંતે	વર્ધના અંતે
નં.		૩૧.૧૨.૨૦૨૪ અનઓડિટેડ	૩૦.૦૯.૨૦૨૪ અનઓડિટેડ	૩૧.૧૨.૨૦૨૩ અનઓડિટેક	૩૧.૧૨.૨૦૨૪ અનઓડિટેડ	૩૧.૧૨.૨૦૨૩ અનઓડિટેડ	૩૧.૦૩.૨૦૨૪ અનઓડિટેક
		अन्या ५८५	અનઆકટક	અનઆક્ટક	અનઆક્રક	अन्साऽटऽ	अनुसाइटड
1	કામકાજમાંથી આવક	2,253.92	2,494.97	2,334.33	7,517.18	7,924.15	10,528.34
2	વેરા પૂર્વે ગાળાનો ચોખ્ખો નફો/ તોટો (અપવાદરૂપ ચીજો અને/અથવા અસાધારણ ચીજો પહેલા)	188.65	273.83	375.69	688.39	786.02	822.99
3	વેરા પૂર્વે ગાળાનો સોખ્ખો નફો/(તોટો) (અપવાદરૂપ ચીજો અને અસાધારણ ચીજો પછી)	188.65	273.83	375.69	688.39	786.02	822.99
4	વેરા પછી ગાળાનો ચોખ્ખો નફો / (તોટો) (અપવાદરૂપ ચીજો અને/અથવા અસાધારણ ચીજો પછી)	139.03	188.29	281.32	480.69	595.94	714.12
5	ગાળાની કુલ સમાવેશક આવક (ગાળાનો કુલ સમાવેશક નફો/તોટો (વેરા પછી) અને અન્ય સમાવેશક આવક (વેરા પછી) સહીત)	139.03	188.29	281.32	480.69	595.94	714.46
6	ઇક્વિટી શેર મુડી	2,418.00	2,418.00	2,418.00	2,418.00	2,418.00	2,418.00
7	અનામતો (પુન:મુલ્યાંકીત અનામતો સિવાયની)	-	-	-	-	-	6,109.74
8	શેરદીઠ કમાણી પ્રતિદિઠ રૂા.૧૦/– ની (ચાલુ અને બંધ કામકાજો માટે)						
	૧. મુળ (રૂપિયામાં)	0.57	0.78	1.22	1.99	2.58	3.04
	૨. ધટાડેલી (રૂપિયામાં)	0.57	0.78	1.22	1.99	2.58	3.04

૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પુરા થતાં ત્રિમાસિક અને નવ માસિક

ગાળાના અન ઓડિટેડ અલાંચદા નાણાંક્યિ પરિણામોનું નિવેદન (રૂ. લાખમાં, ઇપીએસ અને અન્થથા જણાવ્યા સિવાર)								
								કમ નં.
૩૧.૧૨.૨૦૨૪ અનઓડિટેડ	30.0૯.૨૦૨૪ અનઓડિટેડ	૩૧.૧૨.૨૦૨૩ અનઓડિટેક	૩૧.૧૨.૨૦૨૪ અનઓડિટેડ	૩૧.૧૨.૨૦૨૩ અનઓડિટેક	૩૧.૦૩.૨૦૨૪ અનઓડિટેક			
1	કામકાજમાંથી આવક	2,253.92	2,494.97	2,334.33	7,517.18	7,924.15	10,528.34	
2	વેરા પુર્વે ગાળાનો ચોખ્ખો નફો/ તોટો (અપવાદરૂપ ચીજો અને/અથવા અસાધારણ રીજો પહેલા)	187.87	273.09	375.34	685.84	783.15	820.47	
3	વેરા પૂર્વે ગાળાનો સોખ્ખો નફો/(તોટો) (અપવાદરૂપ ચીજો અને અસાધારણ ચીજો પછી)	187.87	273.09	375.34	685.84	783.15	820.47	
4	વેરા પછી ગાળાનો ચોખ્ખો નફો / (તોટો) (અપવાદરૂપ ચીજો અને/અથવા અસાધારણ ચીજો પછી)	138.25	187.56	280.96	478,14	593,07	711,60	
5	ગાળાની કુલ સમાવેશક આવક (ગાળાનો કુલ સમાવેશક નફો/તોટો (વેરા પછી) અને અન્ય સમાવેશક આવક (વેરા પછી) સહીત)	138.25	187.56	280.96	478.14	593.07	711.94	
6	ઇક્વિટી શેર મુડી	2,418.00	2,418.00	2,418.00	2,418.00	2,418.00	2,418.00	
7	અનામતો (પુન:મુલ્યાંકીત અનામતો સિવાયની)	-	-	-	-	-	5,824.30	
8	શેરદીઠ કમાણી પ્રતિદિઠ રૂા.૧૦/– ની (ચાલુ અને બંધ કામકાજો માટે)							
	૧. મુળ (રૂપિયામાં)	0.57	0.78	1.22	1.99	2.58	3.03	
	૨. ધટાડેલી (રૂપિયામાં)	0.57	0.78	1.22	1.99	2.58	3.03	

...... ૧.ઉપરોક્ત અનઓડિટેડ નાણાંકિય પરિણામોનીઓડિટ કમીટી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ કંપનીના બોર્ડ ઓફ્ડ ડાયરેક્ટર્સે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ યોજાયેલ તેમની બેઠકમાં મંજુર કર્યા હતાં.

૨. ઉપરોક્ત પરિમામો કંપની (ભારતીય એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમો . ૨૦૧૫ સાથે વંચાતા કંપની કાયદા .૨૦૧૩ની કલમ ૧૩૩ હેઠળ નિયત ભારતીય એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ (ઇન્ડ એએસ) અને સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ્ઇન્ડિયા

(સેબી) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ તૈયાર કરાયેલ છે. ૩. ઇન્ડએએસ ૧૦૮ એ રીતે ધોરણો સ્થાપિત કરે છે કે કામકાજી સેગમન્ટ્સ અંગે પબ્લીક બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ રીપોર્ટની માહિતી અને ભૌગોલિક વિસ્તારો અંગે સંબંધિત માહીતી આપે છે. કંપુનીના કામકાજો મુખ્યત્વે વ્યવસાયિક કામગીરીને પ્રોત્સાહીત કરવા માટે છે. ઇન્ડ એએસ ૧૦૮ માં દર્શાવેલ, મનેજમેન્ટ એપ્રોચના ધોરમે, ચીફ ઓપરેટીંગ ડિસિઝન મેક્ટ પ્રાપ્તાહારા 'કરવા નાટ છે. ઇન્ડ અંજાર ૧૯૮ ના દશાવા, નાબભગ્ટ અપ્રાથભા દારન, ચાર અપરદાગ કારાઇંગ સુંચર્કના પૃથ્થકરણના આધારે-નોતોની ફાળવણી કરે છે. તદ્દઅનુસારમાહીતીભીગોલિક વિસ્તારો દ્વારા વિવિધ કામગીરીના સુંચર્કના નિવેદનો તૈયાર કરવામાં વપરાયેલ હિસાબી સિલ્ફાંતતો બુદાબુગા વિસ્તારોમાં નોંધાયેલ આવક અને ખર્ચને લાગુ પડે છે. કંપની જીઓગ્રીફીક સેગ્મન્ટોને આધારે રીપોર્ટીંગ માટે સેગમ્ન્ટ રીપોર્ટીંગ અંગે ઇન્ડ એએસ હેઠળ જણાવેલ ૩જા બ્રિમાસિક . રમિયાન અને નાણાંકિય વર્ષ ૨૦૨૩–૨૪ ના ૩ત્રીમાસિક સુધી કોઇ નોંધપાત્ર સેગમન્ટની ઓળખ આપેલ નથી.

. પાછલા ગાળાના આંકાડાઓ વર્તમાન ગાળાના વર્ગીકરણ સાથે ખાતરી કરવા માટે જરૂર જણાઈ ત્યાં

(કીઆઇએન:૦૧૭૧૮૧૦૨)

. વેરા ખર્ચમાં વર્તમાન વેરા અને વિલંબિત વેરાનો સમાવેશ થાય છે

યુર્નવર્ગીકૃત/પુર્નગહિત કરાચેલ છે. દુઁ. શેર દીઠ કમાણી સિવાચ તમામ આંકડાઓ લાખમાં છે. () માં આપેલ આંકડા ઘટાડો/તોટો દર્શાવે છે

ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર

તારીખ : ૧૩.૦૨.૨૦૨૫